



દર્દી અને સંભાળદાતા શિક્ષણ

માથા અને ગરદનના કેન્સરની સારવાર દરમિયાન આહાર અને પોષણ

આ માહિતી તમને શીખવશો કે તમારા માથા અને ગરદનના કેન્સર માટેની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અથવા બંને દરમિયાન તમારી આડઅસરોનું નિયંત્રણ કરવા માટે તમારા આહારમાં કેવી રીતે ફેરફાર કરી શકો છો.

તમારી કેન્સરની સારવાર પહેલાં, દરમિયાન અને પછી પૂરતું પોષણ મેળવવું મહત્વપૂર્ણ છે. પૂરતું પોષણ મેળવવું તમને આમાં મદદ કરી શકે છે:

- તમારી શક્કિત જાળવી રાખવા માટે
- તમારું વજન સ્થિર રાખવા માટે
- ચેપ સામે લડવા માટે
- ઓછી આડઅસર કરવા માટે
- સજરૂરી પછી સાજા થવા માટે

તમારી સારવાર પહેલાં ઓછામાં ઓછા એક વાર આ સંસાધન વાંચો. તમે તમારી સારવાર દરમિયાન અને પછી રેફરન્સ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમારી સારવાર દરમિયાન અલગ-અલગ સમયે સૌથી વધુ ઉપયોગી માહિતી શોધવામાં તમારી મદદ કરવા માટે તમે જમણી બાજુના "Navigate this article" નામની લિંકનો ઉપયોગ કરી શકો છો.

સારવાર દરમિયાન અને પછી તમારા આહારનું આયોજન કરવામાં તમને મદદ કરવા માટે ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ પણ ઉપલબ્ધ છે. તમને પૂરતું પોષણ મળે તેની ખાતરી કરવામાં તેઓ મદદ કરી શકે છે. ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ સાથે એપોઇન્ટમેન્ટ લેવા માટે, 212-639-7312 પર કોલ કરો અથવા તમારી હેલ્થકેર ટીમના સભ્યને તમારી મદદ કરવા માટે કહો.

સારવાર દરમિયાન તમારું પોષણ વિશે

સારી રીતે સંતુલિત આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે જેથી સારવાર દરમિયાન તમને પૂરતું પોષણ મળે. આ તમારું વજનને સ્થિર રાખવામાં અને તમારા સ્નાયુઓ અને શક્કિતને જાળવી રાખવામાં મદદ કરશે.

તમારા ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ નીચે આપેલા બોક્સમાં તમારી પોષક જરૂરિયાતો લખશે. તમારા ભોજનનું આયોજન કરતી વખતે તેનું ધ્યાન રાખવું.

- તમારે દરરોજ _____ ક્લેરીની જરૂર છે
- તમારે દરરોજ _____ ગરૂમ પરોટીની જરૂર છે
- તમારે દરરોજ _____ ઓસ પર્વાહીની જરૂર છે

તમાર વજન પર નજર રાખવા વિશે

સારવાર દરમિયાન તમારું વજન ટ્રેક કરવું જરૂરી છે. તમારા ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ તમને કહે તેટલી વાર અથવા દર 3 થી 5 દિવસે તમારું વજન કરો દરરોજ એક જ સમયે તમારું વજન કરવું શરેષ્ઠ છે. ધ્યાન માં રાખવું કે તમે દરેક વખતે સમાન પરમાણમાં કપડાં પહેરી રહ્યાં છો અને તે જ મશીનનો ઉપયોગ કરો છો.

તમારી સારવાર દરમિયાન વજન ઘટવું સામાન્ય છે. તમારા ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ તમને વધુ વજન ઘટાડતા અટકવામાં મદદ કરવા માટે તમારી સાથે કામ કરશે. જો તમારું વજન ઘણું ઓછું થઈ રહ્યું હોય, અથવા તમારા આહારમાં મદદની જરૂર હોય, તો ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટની મુલાકાત લો.

સારવાર દરમિયાન આડઅસરો

રેડિએશન અને કીમોથેરાપી સારવારની આડ અસરો અમુક સમયે ખાવાનું મુશ્કેલ બનાવી શકે છે. તમારી આડઅસરોને કારણે તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે. આ કરવાથી તમને પયાર્પ્સ્ટ પોષણ મેળવવામાં મદદ મળી શકે છે જેથી તમે વધારે વજન ન ગુમાવો અને તમને સાજા થવા માં મદદ મળે.

નીચે આપેલ કોષ્ટક તમને કેટલીક સામાન્ય આડઅસરો જે તમને હોય અને તમને તે ક્યારે થઈ શકે છે તેની યાદી આપે છે. તમને આમાંથી અમુક, બધી અથવા કોઈ પણ આડઅસર હોઈ શકે છે. જો તમને નીચેની આડઅસરોમાંથી ગમે તે એક હોય તો, તો તમે ખોરાકમાં ફેરફાર વિશે જાણવા માટે “Tips for managing common side effects” વિભાગ વાંચી શકો છો જે તમારા માટે ખાવાનું સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

| રેડિએશન ટ્રીટમેન્ટનું અઠવાડિયું | સામાન્ય આડ અસરો |
|---------------------------------|--|
| અઠવાડિયા 1 થી 3 | <ul style="list-style-type: none"> • સ્વાદમાં ફેરફાર અથવા સ્વાદનો અભાવ • મોઢાના ચાંદા • થાક (સામાન્ય કરતાં વધુ થાક અથવા નબળાઈની લાગણી) • ભૂખ ઓછી લાગવી (ભૂખ ન લાગવી) |

| | |
|--|--|
| <p>4 થી 6 અઠવાડિયા</p> | <ul style="list-style-type: none"> સ્વાદમાં ફેરફાર અથવા સ્વાદનો અભાવ મોમાં ચાંદા અને ગળતી વખતે પીડા થાક ભૂખ ઓછી લાગવી જાડા લાળ અથવા કષ સુકાઈ ગયેલું મો ઉબકા (તમે ઉલટી કરવા જઈ રહ્યા છો એવું લાગવું) |
| <p>સારવાર સમાપ્ત થયાના 2 અઠવાડિયા પછી</p> | <ul style="list-style-type: none"> અઠવાડિયા 4 થી 6 જીવુજ |
| <p>સારવાર સમાપ્ત થયાના 1 મહિના પછી</p> | <ul style="list-style-type: none"> સ્વાદમાં ફેરફાર અથવા સ્વાદનો અભાવ ગળતી વખતે પીડા જાડા લાળ અથવા કષ સુકાઈ ગયેલું મો |

સામાન્ય આડઅસરોનું નિયંતરણ કરવા માટેની ટીપ્સ

સ્વાદમાં ફેરફાર અથવા સ્વાદનો અભાવ

જો તમને સ્વાદમાં ફેરફાર અથવા સ્વાદનો અભાવ થાઈઃ

- તમારા ખોરાકમાં મરીનેડ્રુસ, જડીબુટ્ટીઓ અથવા મસાલા ઉમેરવાનો પર્યાસ કરો. જો તમને પણ મોઢામાં ચાંદા હોય અથવા ગળી જવામાં તકલીફ હોય તો આને તમારા ખોરાકમાં ઉમેરશો નહીં.
- જો તમારા મોમાં ધાતુનો સ્વાદ આવે, તો પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરો અને કેનમાંથી પીવાનું ટાળો.
- સારવાર દરમિયાન તમારા મનપસંદ ખોરાકને મયારદિત અથવા ટાળવું શરેખ્ઘઠ છે. તમારી યાદ પરમાણો તે કદાચ સ્વાદમાં નહીં આવે. આનાથી તમે ભવિષ્યમાં આ ખોરાકને નકારાત્મક વિચારો સાથે જોડી શકો છો.

મોમાં ચાંદા અને ગળતી વખતે પીડા

જો તમને મોઢામાં ચાંદા હોય, ગળતી વખતે તકલીફ હોય અથવા બંને હોય:

- નરમ, મૂદુ ખોરાક ખાવાનો પર્યાસ કરો. તમે આના વિશે "Soft and Bland Foods" વિભાગમાં વાંચી શકો છો.
- ઉકળતું ગરમ ખોરાક અને પીણાને ટાળો.
- એસિડિક ફળો (જેમ કે નારંગી, દર્દક્ષ, લીંબુ અથવા મોસંબી) ખાશો નહીં અથવા એસિડિક ફળોનો રસ પીવો નહીં.
- મસાલેદાર ખોરાક ન ખાવો.
- ટોસ્ટ અથવા વેફર જેવા ખરબચડી ટેક્સચરવાળા ખોરાક ન ખાવો.

- રાહત માટે દર 4 થી 6 કલાકે અથવા વધુ વખત તમારા મોને કોગળા કરો. નીચેનામાંથી 1 પર્વાહીનો ઉપયોગ કરો:

- એક ક્વાટર (4 કપ) પાણી 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાવાનો સોડા સાથે મિશિસ્ત
- એક ક્વાટર પાણીમાં 1 ચમચી મીઠું મિક્સ કરો
- એક ક્વાટર પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરો
- પાણી
- આલ્કોહોલ અથવા ખાંડ વગરનું માઉથવોશ

કોગળા કરવા માટે, 15 થી 30 સેકન્ડ માટે પર્વાહીને સ્થિરશ કરો અને ગાગરલ કરો, પછી તેને થૂંકો.

જો આ ટીપ્સ તમારા મોમાં દુખાવો અથવા ગળવાની પીડામાં મદદ ન કરતી હોય, તો તમારા આરોગ્યસંભાળ પરદાતાને જણાવો. તેઓ રાહત માટે દવા આપી શકે છે.

તમે તમારા આરોગ્યસંભાળ પરદાતાને ગળવાની નિષ્ણાતને રેફરલ માટે પણ કહી શકો છો. તેઓ સલામત અને ગળવામાં સરળ હોય તેવા ખોરાક અને પર્વાહીની ભલામણ કરી શકે છે.

સારવાર દરમિયાન ગળવામાં થતા પીડા અને મોની સંભાળ વિશે વધુ માહિતી માટે, નીચેના સંસાધનો વાંચો:

- તમારા માથા અને ગરદન માટે રેડિયેશન થેરપી: તમારે ગળવા વિશે શું જાણવું જરૂરી છે (<https://sandbox18.mskcc.org/gu/cancer-care/patient-education/radiation-therapy-head-and-neck-swallowing>)
- *Mouth Care During Your Cancer Treatment* (<https://sandbox18.mskcc.org/cancer-care/patient-education/mouth-care-during-your-treatment>)

થાક

જો તમને આખું ભોજન બનાવવામાં ખૂબ થાક લાગે છે, તો તૈયાર ખોરાક કે જે ઝડપથી રંધાય જાય તેવા ખોરાક ખાવાનો પર્યાસ કરો. તમે દહી, પનીર, સખત બાફેલા ઈંડા, ટુના સલાડ, તૈયાર કરીમી સૂપ અથવા અગાઉથી રાંધેલ રોટિસેરી ચિકન જેવી સિંગલ-સવિરંગ વસ્તુઓ પણ અજમાવી શકો છો.

ભૂખ ઓછી લાગવી

જો તમને ભૂખ ન લાગે તો આ ટિપ્સ અજમાવી જુઓ.

- વારંવાર થોડું ભોજન લો અને મોટા, ભારે ભોજન ટાળો. ઉદાહરણ તરીકે, દિવસમાં 3 મોટા ભોજનને બદલે 6 નાના ભોજન લો.

- વધુ કેલરી અને પરોટીન ધરાવતો ખોરાક લો. વધુ માહિતી માટે “Increasing Your Calorie and Protein Intake” વિભાગ વાંચો.
- સુખદ વાતાવરણમાં ખાઓ, જેમ કે બારી સામે અથવા તમને ગમે તેવી બીજી જગ્યા.
- જો તમને તે મદદરૂપ લાગે તો મિતરો અને પરિવાર સાથે ખાઓ.
- વધુ પોષણ મેળવવાના આઈડિયા માટે “Making nutritional shakes to increase protein and calories” વિભાગ વાંચો.
- જો તમને પૂરતું ખાવામાં તકલીફ પડી રહી હોય, તો તમારી હેલ્થકેર ટીમના સભ્ય સાથે વાત કરો.

જાડા લાળ

જો તમારા ગળામાં જાડા લાળ હોય તો:

- દિવસ દરમિયાન સ્પષ્ટ પર્વાહી ચૂસવું. આમાં પાણી, નોન-એસિડિક ફળોનો રસ, સ્પોટ્સર ડિરંક્સ, બરોથ, Ensure® Clear અથવા Boost® Breeze નો સમાવેશ થઈ શકે છે.
- ગરમ પાણી અથવા મધ સાથે ગરમ ચા પીવો.
- જો તમને મોઢામાં ચાંદા ન હોય, તો ક્લબબ સોડા વડે ગાગરલ કરવાનો પર્યાસ કરો.

સુકાઈ ગયેલું મો

જો તમારું મો સુકાઈ ગયું હોય તો:

- નરમ, ભેજવાળા ખોરાક પસંદ કરો, જેમ કે તરબૂચ, દહી અને ખીર. વધુ આઈડિયા માટે, “Soft and Bland Foods” વિભાગ વાંચો.
- આઇસ પોપ્સ ચૂસવું.
- તમારા ખોરાકમાં ગરેવી, ચટણી, સફરજનની ચટણી અથવા અન્ય પર્વાહી ઉમેરો.
- ભોજન કરતી વકતે દરેક કોણિયો વચ્ચે એક ચમચી ગરમ સૂપ અથવા અન્ય પર્વાહી લો.
- જિલેટીનથી બનેલા ખોરાકને અજમાવો, જેમ કે મૌસ અથવા Jell-O®. તે તમારા ગળામાં વધુ સરળતાથી સરકતા હોય છે.
- હંમેશા તમારી સાથે પાણીની બોટલ રાખો. તમે પાણીથી ભરેલી નાની, સ્વવ્યાઘ સ્પરે બોટલ સાથે લઈ જવાનો પણ અજમાવી શકો છો. તમારા મોમાં આખો દિવસ પાણીનો છંટકાવ કરો જેથી તે ભીની રહે.
- વધુ લાળ બનાવવા માટે સુગર-ફરી કુદીના ની ગોળી અથવા લીબુની ગોળી ખાવાનો અથવા સુગર-ફરી ગમ ચાવવાનો અજમાવો.
- પેર, પીચ અને જરદાળુ જેવા ફળોના અમૃત ચૂસો અને પપૈયાનો રસ પીવો.

- ઓવર-ધ-કાઉન્ટર (પિરસિક્રપ્શન નહીં) લાળ પૂરક અજમાવવા વિશે તમારા આરોગ્યસંભાળ પરદાતા સાથે વાત કરો.
- આલ્કોહોલિક પીણાં અને કેફીન પીણાં ટાળો.
- આલ્કોહોલ ધરાવતા માઉથવોશ ટાળો.
- શુષ્ઠુક, સ્ટાચર્યુક્ત ખોરાક જેમ કે ટોસ્ટ, વેફર અથવા સૂકા સેરિયલ ખાવાનું ટાળો.

ઉબકા

મોટાભાગના આરોગ્યસંભાળ પરદાતાઓ ઉબકાની સારવાર માટે અથવા તેને થતું અટકાવવા માટે દવા લખી આપશે. જો તમને ઉબકા આવે છે, તો તમે તેને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે નીચેની માગરદશિરકાને પણ અનુસરી શકો છો.

- મસાલેદાર ખોરાક ન ખાવો.
- વધુ ચરબીવાળો ખોરાક ન ખાવો, ખાસ કરીને તળેલા ખોરાક, જેમ કે ડોનટ્સ, ફ્રેન્ચ ફ્રોઝિસ, પિઝા અને પેસ્ટરી.
- જમ્યા પછી તરત જ સૂવાનું ટાળો.
- જો ખોરાકની ગંધ તમને પરેશાન કરે છે, તો તમારો ખોરાક ઓરડાના તાપમાને અથવા ઠંડુ ખાવાનો પર્યાસ કરો. ખૂબ ગરમ ખોરાક ટાળો. તેમાં ઘણી વખત તીવ્ર ગંધ હોય છે જે ઉબકાને વધુ ખરાબ કરી શકે છે.
- ભોજન વારંવાર અને થોડું લો. ઉદાહરણ તરીકે, દિવસમાં 3 મોટા ભોજનને બદલે 6 નાના ભોજન લો.
- ખાવામાં સમય કાઢો અને તમારા ખોરાકને સારી રીતે ચાવવું જેથી તે પચવામાં સરળતા રહે.
- એક જ સમયે મોટી માતરામાં પર્વાહી પીશો નહીં. આ તમને વધુ પડતું લેવાથી બચાવશે. વધુ પડતું લેવાથી ઉબકા વધુ ખરાબ થઈ શકે છે.
- આદુની ચા, આદુની આલે, બિન-આલ્કોહોલિક આદુની બિયર અથવા વાસ્તવિક આદુ ધરાવતી કેન્ટ્ડીઝ ચૂસવાનો પર્યાસ કરો. આદુ સુખદાયક હોઈ શકે છે અને ઉબકામાં મદદ કરી શકે છે.
- ઓછી ચરબીવાળા, સ્ટાચર્યુક્ત ખોરાક ખાવાનો પર્યાસ કરો. આ ખાદ્યપદાથોર્થી તમને ઉબકા આવવાની શક્યતા ઓછી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ચોખા, સફેદ ટોસ્ટ, કરેકર, ચીરીઓ, મેલ્બા ટોસ્ટ અથવા એન્જલ ફૂડ કેકનો અજમાવો.
- ક્ષારચુક્ત ખોરાક ખાવાનો પર્યાસ કરો, જેમ કે પ્રેટ્ઝેલ્સ અથવા ખારા કરેકરસ.

સારવાર માટેની અન્ય ટીપ્સ

- તમારી સારવાર દરમિયાન તમારા મોને સૂવચ્છ રાખવું મહત્વપૂર્ણ છે. નિયમિતપણે તમારા દાંત સાફ કરો. તમારા મોની સારી કાળજી લેવામાં તમારી મદદ કરવા માટેની અન્ય રીતો માટે સંસાધનમાં

[**bXNrLW5vZGUtbGluazogMjA0NjQ=**] માગરદશિરકા અનુસરો.

- જો તમારા ડોક્ટરે તમને પીડા, ઉબકા (તમે ઉલ્ટી કરવા જઈ રહ્યાં છો તેવી અહેસાસ), અથવા બંને માટે દવા સૂચવી હોય, તો તમારે તમારા ડોક્ટર સાથે તે લેવાનો શરેખ્ઘ સમય વિશે વાત કરવી જોઈએ. કેટલાક ડોક્ટરો ભોજન પહેલાં આ દવાઓ લેવાની સલાહ આપે છે.

ખોરાક નળી પ્લેસમેન્ટ

જો તમારી આડઅસર તમને પૂરતું પોષણ મેળવવામાં રોકી રહી છે અથવા તમને ગુંગળામણના જોખમમાં મૂકે છે, તો તમારે ફીડિંગ ટ્યુબ મુકવાની જરૂર પડી શકે છે. તમારી સારવાર દરમિયાન અથવા પછી ફીડિંગ ટ્યુબ મૂકી શકાય છે.

જો તમારી પાસે ફીડિંગ ટ્યુબ હોય, તો તમારા ક્લિનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ અથવા ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (GI) ન્યુટ્રિશન ડોક્ટર સાથે વાત કરો જેથી ખાતરી કરી શકાય કે તમને પૂરતું પોષણ અને પર્વાહી મળી રહ્યું છે. તેઓ તમને અનુસરવા માટે એક આહાર આપશે.

તમારી કેલરી અને પરોટીનનું સેવન વધારવું

કેન્સરની સારવાર દરમિયાન પૂરતી કેલરી અને પરોટીન ખાવું મહત્વપૂર્ણ છે જેથી તમે તમારું વજન જાળવી શકો. યાદ રાખો કે આ સામાન્ય ટિપ્સ છે. દરેક વ્યક્તિ અલગ હોય છે તેથી તમારા માટે શરેખ્ઘ કામ કરતી ટિપ્સ અજમાવવી મહત્વપૂર્ણ છે.

- મરધાં, માંસ, ઈંડા, કઠોળ, નટ્સ અને નટ માખણ અને ડેરી ઉત્પાદનો પરોટીનના સારા સ્તરોત છે. તમારે તમારા બધા ભોજન અને નાસ્તામાં પરોટીનથી ભરપૂર ખોરાક પસંદ કરવાનો પર્યાસ કરવો જોઈએ.
- નટ્સ અને નટ ના માખણ, એવોકાડો, ઓલિવ અથવા કેનોલા તેલ અને સંપૂર્ણ ચરબીવાળા ડેરી ઉત્પાદનો કેલરીના સારા સ્તરોત છે. તમારા આહારમાં એને ઉમેરવાથી તમને વધુ કેલરીના સેવન માં મદદ મળી શકે છે.
- જો તમને તમારું વજન જાળવવામાં તમને મુશ્કેલી પડી રહી હોય, તો પાણીને બદલે કેલરીવાળા પીણાં પસંદ કરો. ફળોના રસ, ફળોના અમૃત અને પર્વાહી પોષક પૂરવણીઓ, જેમ કે Ensure,® તેના ઉદાહરણો છે.
 - જો તમને ડાયાબિટીસ હોય, તો આ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા ક્લિનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ સાથે વાત કરો. તેઓ તમને બ્લાડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે ખાંડવાળા પીણાં મયાર્દિત કરવાનું અથવા ટાળવાનું કહી શકે છે.
- સારવાર દરમિયાન અને પછી હાઇડ્રેટ રહેવું અને પુષ્કળ પર્વાહી પીવું મહત્વપૂર્ણ છે. જો તમે જાણવા માંગતા હો કે તમારે દરરોજ કેટલું પર્વાહી પીવું જોઈએ, તો તમારા ક્લિનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ સાથે વાત કરો.

નીચે એવા ખોરાકનું કોષ્ટક છે જેમાં પરોટીન, કેલરી અથવા બંને વધુ હોય છે જે તમે તમારા આહારમાં ઉમેરી શકો છો.

| ખોરાક | લેવાની માત્રા | ક્લેરી | પરોટીન (ગર્ભમ) |
|---|-----------------------|-----------------------------|-------------------|
| સંપૂર્ણ દૂધ | 8 ઓસ | 150 | 8 |
| સ્મૃથ નટ બટર (જેમ કે પીનટ અથવા બદામનું માખણા) | 2 ટેબલસ્પૂન | 200 | 8 |
| પરોમિયમ (ફુલ-ફેટ) આઈસ્ક્રીમ | ½ કપ | 260 | 4 |
| 2% ચરબીયુક્ત સાદા ગરીક દહી | ૧ કપ | 170 | 23 |
| 4% ચરબી અથવા સંપૂર્ણ ચરબીયુક્ત કોટેજ ચીજ | ૧ કપ | 220 | 23 |
| તેલ (જેમ કે ઓલિવ, કેનોલા અથવા નાળિયેર) | 1 ટેબલસ્પૂન | 100 | 0 |
| વે પરોટીન પાવડર | બોટલ પરની સૂચનાઓ મુજબ | 100 થી 170 (બરાન્ડના આધારે) | 15 થી 30 |
| એવોકાડો | ½ કપ, ક્યુબ કરેલ | 120 | 2 |
| હળવું છીણેલું ચીજ | ½ કપ | 230 | 14 |
| હેવી કરીમ | 1 ટેબલસ્પૂન | 50 | 0 |
| કરીમ ચીજ | 1 ટેબલસ્પૂન | 50 | 1 |
| ફુલ-ફેટ રિકોટા ચીજ | ¼ કપ | 100 | 7 |
| રાંધેલા કઠોળ (જેમ કે ચાણા) | ૧ કપ | 295 | 16 |
| બાષ્પીભવન કરેલું દૂધ | ૧ કપ | 320 | 16 |
| મેયોનેજ સાથે ચિકન સલાદ | ૧ કપ | 420 | 26 |
| મેયોનેજ સાથે ઈંડા સલાદ | 1 કપ | 570 | 23 |
| મેયોનેજ સાથે ટુના સલાદ | 1 કપ | 400 | 22 |
| મધ (પાશ્ચયરાઇઝડ) | 1 ટેબલસ્પૂન | 65 | 0 |
| ઓટમીલ (દૂધમાંથી બનાવેલ) | 1 કપ | 250 | 12 |
| ઘઉની કરીમ (દૂધમાંથી બનાવેલ) | 1 કપ | 240 | 12 |
| પાસ્તા, રાંધેલ | 1 કપ | 220 | 8 |
| ગરીટ્સ (દૂધમાંથી બનાવેલ) | 1 કપ | 235 | 11 |
| મેકરોની અને ચીજ | 1 કપ | 500 | 19 |
| સૂકું, ફુલ-ફેટ દૂધ પાવડર | 3 ટેબલસ્પૂન | 120 | 6 |
| સફરજનનો રસ | 8 ઓસ | 115 | 0 |

| | | | |
|---------------|-------------|------------|----|
| દર્શકનો રસ | 8 ઓસ | 150 | 0 |
| પીચ અમૃત | 8 ઓસ | 135 | 0 |
| આલ્ફરેડો સોસ | ½ કપ | 550 | 10 |
| જેલી અથવા જામ | 1 ટેબલસ્પૂન | 50 to 60 | 0 |
| ક્રિલફ બાર® | 1 બાર | 280 to 300 | 5 |

ઘરે બનાવેલા ન્યુટ્રિશનલ શેક્સ

શેક અથવા સ્મૂધી બનાવવાથી તમને દરરોજ મળતી કેલરી અને પરોટીનની સંખ્યા વધારવાનો એક શરેખ્ઠ રસ્તો છે. તમારી સારવારના અંત સુધીમાં, તમે કેવું અનુભવી રહ્યા છો તેના આધારે, તમે ફક્ત શેક પીતા હશો.

નીચેના ચાટરમાં શેક બનાવવા માટે તમે ઉપયોગ કરી શકો તેવા વિવિધ બેજ (આધાર) અને મિક્સ-ઇન્સના ઉદાહરણો છે. તમારે નીચે આપેલા કોષ્ટકમાં સૂચિબદ્ધ પર્વાહી પોષણ પૂરકોમાંથી એકને આધાર તરીકે પસંદ કરવું જોઈએ અને જો જરૂરી હોય તો, તમારી કેલરી વધારવા માટે તમે જે પણ મિશરણ ઉમેરવા માંગો છો તે ઉમેરો. જો તમે ઇચ્છા તો, તમે પર્વાહી પોષક પૂરવણીઓ જાતે પી શકો છો.

તમે દરરોજ કેટલા શેક પી રહ્યા છો તેનો ટરેક રાખવા માટે આ ચાટરનો ઉપયોગ કરો. તમારા ક્રિલનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ તમને કહેશે કે તમારે દરરોજ કેટલી સવિરંગ લેવી જોઈએ.

શેક બેજ

| ઉત્પાદન નામ | પીરસવાની માત્રા | કેલરી | પરોટીન (ગરામ) | ખાવામાં આવતી સવિરંગ્ઝસ |
|---------------------------|-----------------|------------|---------------|------------------------|
| Ensure Plus ® | 8 ઓસ | 350 | 13 | |
| Boost Plus ® | 8 ઓસ | 360 | 14 | |
| આખા દૂધ સાથે Scandishake® | 8 ઓસ | 600 | 12 | |
| Muscle Milk ® | 10 થી 17 ઓસ | 170 થી 340 | 18 થી 34 | |
| Boost ® ખૂબ ઊંચી કેલરી | 8 ઓસ | 530 | 22 | |
| Boost ® ઉચ્ચ પરોટીન | 8 ઓસ | 240 | 15 | |
| Glucerna® | 8 ઓસ | 190 | 10 | |
| Boost ® ગ્લુકોજ નિયંત્રણ | 8 ઓસ | 190 | 16 | |
| Protein Premium® | 11 ઓસ | 160 | 30 | |
| Ensure® ઉચ્ચ પરોટીન | 8 ઓસ | 210 | 25 | |
| Boost® Compact | 4 ઓસ | 240 | 10 | |
| Boost Breeze ® | 8 ઓસ | 250 | 9 | |

| | | | | |
|--------------------|--------|-----|----|--|
| MightyShakes® | 8 ½ ઔસ | 500 | 23 | |
| Soylent | 14 ઔસ | 400 | 20 | |
| Orgain® (પર્વતાહી) | 11 ઔસ | 255 | 16 | |

શેક મિક્સ-ઇન્સ

| ઉત્પાદન નામ | પીરસવાની માત્રા | કેલરી | પરોટીન (ગરામ) | ખાવામાં આવતી સવિરંગ્રસ |
|---|-----------------|-------|---------------|------------------------|
| સંપૂર્ણ દૂધ | 8 ઔસ | 150 | 8 | |
| બદામનું દૂધ | 8 ઔસ | 60 | 1 | |
| હેવી કરીમ | 2 ઔસ | 200 | 1 | |
| નાભિયેરની કરીમ | 2 ટેબલસ્પૂન | 140 | 0 | |
| કેળા | 1 મધ્યમ | 100 | 1 | |
| પરોમિયમ આઈસ્કરીમ | ½ કપ | 260 | 5 | |
| 2% સાદા ગરીક દહી (જેમ કે Fage®) | 1 કપ | 170 | 23 | |
| વનસ્પતિ તેલ | 1 ½ ઔસ | 350 | 0 | |
| Benecalorie® | 1 ½ ઔસ | 330 | 7 | |
| વે પરોટીન પાવડર (જેમ કે CVS બરાન્ડ) | 1 સ્કૂપ | 150 | 26 | |
| વનસ્પતિ આધારિત પરોટીન પાવડર (જેમ કે Orgain® ઓગેરનિક પરોટીન પાવડર) | 4 ઔસ | 240 | 10 | |
| મગફળીનું માખણ | 2 ટેબલસ્પૂન | 190 | 8 | |
| પાવડર પીનટ બટર (જેમ કે PB2®) | 2 ટેબલસ્પૂન | 45 | 5 | |
| દૂધ પાવડર | ½ કપ | 75 | 4 | |
| મિશર્બેરી | ¾ કપ | 50 | 0 | |

નરમ અને સૌમ્ય ખોરાક

નીચેના ખોરાક નરમ અને સ્વાદમાં કોમળ છે. જો તમને મોઢામાં ચાંદા કે દુખાવો હોય તો તે ખાવા માટે સારા છે.

| ખાદ્ય જૂથ | સૂચવેલ ખોરાક |
|----------------------|---|
| દૂધ અને ડેરી ઉત્પન્ન | <ul style="list-style-type: none"> સંપૂર્ણ દૂધ સાંદું અથવા ફળના ટુકડા વગરનું સારી રીતે ભેણવેલું દહી પાશ્ચયરાઇઝ્ડ એગનોગ |

| | |
|-------------------------|--|
| | <ul style="list-style-type: none"> સોક્કટ ચીજ (જેમ કે કોટેજ ચીજ અથવા પાતળું રિકોટા ચીજ) હળવું અથવા પરોસેસડ ચીજ ઓગાળીને ચટણીમાં |
| શાકભાજી | <ul style="list-style-type: none"> શાકભાજીનો રસ (જેમ કે ગાજરનો રસ) બધી સારી રીતે રાંધેલી, સમારેલી શાકભાજી (જેમ કે ગાજર, વટાણા, લીલા કઠોળ, બીટ, બટરનટ સ્ક્રૂવોશ, વેક્સ બીન્સ) સમારેલી અથવા કરીમ કરેલી પાલક |
| ફળો | <ul style="list-style-type: none"> એસિડિક ન હોય તેવા ફળોના રસ અને અમૃત (જેમ કે સફરજન અને નાસપતી) સરળ સફરજનની ચટણી કોઈપણ કેન ફળો, સહનશીલતા મુજબ છાલ વગરના કોઈપણ રાંધેલા ફળો પાકેલા કેળા |
| સ્ટાચર્ | <ul style="list-style-type: none"> રાંધેલા અનાજ, ઘઉની કરીમ, ફરિના, ચોખાની કરીમ, ઓટમીલ, હોમિની ગિર્ઝટ્સ વિપ અથવા સુંવાળા માસ્ક કરેલા સફેદ બટાકા અથવા શક્કરિયા સારી રીતે રાંધેલા પાસ્તા સફેદ કે ભૂરા ચોખા નરમ આખા અનાજ (જેમ કે જવ અને ફેરો) સોક્કટ બરેડ (જેમ કે સોક્કટ રોલ્સ, મહિન્સ, સોક્કટ ફેન્ન્યુ ટોસ્ટ, પેનકેક) સૂકા સિરિયલને થોડી માત્રામાં દૂધમાં પલાણેલા |
| ચરબી અને તેલ | <ul style="list-style-type: none"> માખણ અથવા માજરરિન સોર કરીમ રસોઈ માટેની ચરબી અથવા તેલ ગરેવી વ્હીપ્લ ટોપિંગ્સ અથવા હેવી કરીમ કરીમી-સ્ટાઇલ સલાડ ડ્રેસિંગ્સ. એસિડિક ડ્રેસિંગ ટાળો. એવોકાડો |
| માંસ અને માંસના વિકલ્પો | <ul style="list-style-type: none"> કોમળ રાંધેલું માંસ, માઇલી અને મરધાં ચિકન સલાડ, ટુના સલાડ, ઈંડા સલાડ (સેલરી કે દુંગાળી વગર) મીટલોફ અથવા મીટબોલ્સ સેલ્મોન લોફ અથવા કરોક્વેટ્સ કેસરોલ્સ બેક કરેલી અથવા બાફેલી માઇલી (જેમ કે સોલ, રફી, ફ્લાઉન્ડર અથવા સેલ્મોનનું ફીલેટ) સ્કરેમ્બલ્લ ઈંડા અથવા સોફ્લે સાદો ચીજ ક્રિવચ હમ્મસ સારી રીતે રાંધેલા કઠોળ ટોકુ |
| સૂપ | <ul style="list-style-type: none"> સૂપ અથવા બ્યુલોન |

| | |
|--------------------|--|
| | <ul style="list-style-type: none"> પ્રયુરી કરેલા અથવા ગાળેલા શાકભાજીવાળા સૂપ કરીમ સૂપ ચિકન નૂડલ અથવા ચોખાનો સૂપ |
| મીઠાઈઓ અને ડેઝટ્સર | <ul style="list-style-type: none"> સાદા કસ્ટડર અને પુર્ડિગ્સ શરબત, આઈસ્ક્રીમ, ફ્રોઝન દહી, મિલ્કશેક Jell-O® ફ્લેવડર ફ્રૂટ આઈસ, પોપિસ્કલ્સ, ફ્રૂટ વ્હીપ્સ, ફ્લેવડર જિલેટીન બીજ વિનાની જેલી મધ, મેપલ સીરપ, ખાંડ, અથવા ખાંડના અવેજી ચોકલેટ સીરપ પોપડા વગરની પાઈ, બીજ કે બદામ વગરની પેસ્ટરી અને કેક, સોફ્ટ ફૂંકીઝ |
| પીણાં | <ul style="list-style-type: none"> બધા પીણાં (જરૂર મુજબ પાણીયુક્ત) |
| વિભિન્ન | <ul style="list-style-type: none"> જડીબુટ્ટીઓ, સીરપ અને ગરેવી |

સારવાર પછી પોષણ માગર્દશિર્કા

તમારી સારવાર સમાપ્ત થઈ જાય પછી પણ, તમારી આડઅસરો વધુ ખરાબ થઈ શકે છે અથવા થોડા સમય માટે ચાલુ રહી શકે છે. આમાં મદદ કરવા માટે, ખાવા-પીવાનું સરળ બનાવવા માટે જરૂર મુજબ તમારા આહારમાં ફેરફાર કરતા રહો. સારું ખાવું અને હાઇડરેટેડ રહેવું મહત્વપૂર્ણ છે જેથી તમારું શરીર સ્વસ્થ થઈ શકે. યોગ્ય રીતે સાજા થવા માટે, તમારા શરીરને વધુ કેલરી અને પરોટીનની જરૂર પડશે. કેટલાક લોકોને જરૂરી પોષણ મેળવવા માટે પર્વાહી ખોરાક, નરમ ખોરાક, અથવા બંને લેવાની જરૂર પડશે. તમારી પોષણ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવા માટે ઘરે બનાવેલા શેક અથવા પર્વાહી પોષણયુક્ત પૂરવણીઓ પીતા રહો.

તમારી સારવાર પૂરી થયાના 1 મહિના પછી તમારા આહારમાં પ્રયુરી અથવા નરમ ઘન ખોરાક ઉમેરવાનું શરૂ કરો. જો તમે તૈયાર હોવ એવું લાગે અને જો તમારા ડોક્ટર તમને કહે કે તે ઠીક છે, તો તમે તે વહેલા ઉમેરવાનું શરૂ કરી શકો છો. તમે દિવસમાં ઓછામાં ઓછા 3 વખત $\frac{1}{4}$ કપ નરમ ઘન અથવા પ્રયુરી કરેલું ખોરાક ખાવાથી શરૂઆત કરી શકો છો. તમારી બાકીની પોષણ જરૂરિયાતોને પૂરણ કરવા માટે તમારે પોષક પૂરવણીઓ પણ લેવી જોઈએ. જો જરૂર પડે તો તમારા ક્લિનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટ સાથે વાત કરો.

તમારી સારવાર પૂરી થઈ ગયા પછી તમે તમારા ક્લિનિકલ ડાયેટિશિયન ન્યુટ્રિશનિસ્ટને મળવાનું પણ ચાલુ રાખી શકો છો.

દૈનિક ખોરાક અને પીણાં લોગ

તમારી સારવાર દરમિયાન પૂરતું ખાવા અને પીવા માટે સહાયરૂપ થાય, આવા તમામ ખોરાક અને પીણાંનો ટરેક રાખવાનો પરયાસ કરો. તમારા ખોરાકને ટરેક કરવાનું શરૂ કરવા માટે તમે નીચેના લોગનો ઉપયોગ કરી શકો છો.

જો તમે તમારા ફોન પર તમારા ખોરાકને ટ્રેક કરવાનું પસંદ કરો છો, તો તમને આમાં મદદ કરવા માટેનું એપ્પિલકેશન (જેમ કે MyFitnessPal) ડાઉનલોડ કરી શકો છો.

| અઠવાડિયાનો દિવસ | ભોજન/નાસ્તો 1 | ભોજન/નાસ્તો 2 | ભોજન/નાસ્તો 3 | ભોજન/નાસ્તો 4 | ભોજન/નાસ્તો 5 |
|-----------------|---------------|---------------|---------------|---------------|---------------|
| રવિવાર | | | | | |
| સોમવાર | | | | | |
| મંગળવાર | | | | | |
| બુધવાર | | | | | |
| ગુરૂવાર | | | | | |
| શુક્રવાર | | | | | |
| શનિવાર | | | | | |

અતિરિક્ત સંસાધનો

નીચેના સંસાધનો તમારી સારવાર દરમિયાન અને પછી સહાય અને અન્ય માહિતી પરદાન કરી શકે છે.

અમેરિકન ઇન્સ્ટટ્યુટ ફોર કેન્સર રિસચર્ચ

www.aicr.org

800-843-8114

આહાર અને કેન્સર નિવારણ, સંશોધન અને શિક્ષણ વિશે માહિતી પૂરી પાડે છે.

મેમોરિયલ સ્ક્લોન કેટરિંગ (MSK) પોષણ

www.mskcc.org/nutrition

MSK ખાતે આપવામાં આવતી પોષણ સેવાઓ વિશે વાનગીઓ, આહાર માગરૂદશિરૂકાઓ અને વધારાની માહિતી પરદાન કરે છે.

મોઢાનું અને માથા અને ગરદનના કેન્સર ધરાવતા લોકો માટે સહાય (SPOHNC)

www.spohnc.org

800-377-0928

SPOHNC એક સ્વ-સહાય સંસ્થા છે જે માથા અને ગરદનના કેન્સરથી પીડાતા લોકોને સહાય પૂરી પાડે છે. તેઓ માસિક ન્યૂઝલેટર મોકલે છે અને સવારઈવર-ટુ-સવારઈવર નેટવર્ક દ્વારા સપોટર ઓફર કરે છે. ન્યૂ યોકર્સ રાજ્યમાં સ્થાનિક પર્કરણો છે.

વધુ માહિતી માટે, માથા અને ગરદનના કેન્સરની સારવાર પહેલાં, દરમ્યાન અને પછી પોષણ વિશે નીચેના વિડિઓઝ

જુઓ:

- *Nutrition Before and During Treatment for Head and Neck Cancer*
(<https://sandbox18.mskcc.org/cancer-care/patient-education/video/nutrition-before-treatment-head-neck>)
- *Nutrition During and After Treatment for Head and Neck Cancer*
(<https://sandbox18.mskcc.org/cancer-care/patient-education/video/nutrition-after-treatment-head-neck>)

If you have questions or concerns, contact your healthcare provider. A member of your care team will answer Monday through Friday from 9 a.m. to 5 p.m. Outside those hours, you can leave a message or talk with another MSK provider. There is always a doctor or nurse on call. If you're not sure how to reach your healthcare provider, call 212-639-2000.

વધુ રિસોસર્સ માટે, અમારી વચ્ચુરાખલ લાઈબ્રેરી www.mskcc.org/peની મુલાકાત કરો

Diet and Nutrition During Head and Neck Cancer Treatment - Last updated on April 17, 2023
તમામ અધિકાર અને માલિકી હક મેમોરિયલ સ્ક્લોન કેટરિંગ કેન્સર સેન્ટર દ્વારા આરક્ષિત છે